

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૨/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૫૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૨૯ વ્યક્તિઓને ઝડપી, ૭૧ લીટર દેશી દારૂ, ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૭ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૨ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૨ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૮૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૫૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૫૭/૧૮

ચાંદખેડા: રામજીભાઈ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૬૫) (રહે. શ્યામલ રેસીડન્સી આઇ.ઓ.સી રોડ ચાંદખેડા) એ તા.૨૦/૦૨/૧૮ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૮/૨૦૧૬ થી તા.૨૭/૦૮/૨૦૧૭ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી સોસાયટીના (૧) બળદેવભાઈ બોધાભાઈ વાઘેલા (ચેરમેન જુના) (૨) રમેશભાઈ માનાભાઈ સેગલ (સેક્રેટરી જુના) (૩) પ્રવિણભાઈ જે પરમાર (વા.ચેરમેન જુના) (૪) દિનેશભાઈ જી ચાવડા (ખજાનચી) (૫) વિજયભાઈ બી જાદવ (તમામ રહે. શ્યામલ રેસીડન્સી આઇ.ઓ.સી રોડ ચાંદખેડા) એ ભેગા મળી ચાંદખેડા આઇ.ઓ.સી.રોડ શ્યામલ રેસીડન્સી સોસાયટીના ફંડના હિસાબમા રૂપિયા ૧,૯૫,૦૦૦/- ઉચાપત કરી સોસાયટીના રહીશો સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.કે.રાઠવા રાઠવા ચલાવે છે.

વીજ કરંટ લાગતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૫૮/૧૮

ગોમતીપુર: ભુમીકાબહેન તુલસીરામ કોષ્ટી(ઉ.વ.૧૪) (રહે. વેણુગોપાલ સોસાયટી ઉમા વિદ્યાલય સામે નવા નરોડા નિકોલ) તા.૨૦/૨/૧૮ સવારના ૧૦/૧૫ વાગ્યાના સુમારે ગોમતીપુર ગજાનંદની ચાલી ખાતે મામા-દાદાના ઘરે હીટરથી પાણી ભરેલ ડોલમાં હીટર રાખી હીટર ચાલુ કરી પાણી ગરમ કરતા હતા ત્યારે ચાલુ ઈલેક્ટ્રીક ડોલના પાણીમાં હાથ નાખતા ઈલેક્ટ્રીક લાગ્યો હતો. સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.જી.ખરાડી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૫૯/૧૮

નરોડા: રૂપલબહેન વા/ઓ દિનેશભાઈ બ્રાહ્મણીયા (ઉ.વ.૩૮) (રહે. ન્યુ અમરપાર્ક સોસાયટી વેદાંત હોસ્પિટલ સામે નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૯/૨/૧૮ કલાક ૦૦/૩૫ વાગે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે નરોડા શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુમા અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ભીખાભાઈ જીવાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.